

श्री

# आत्मानंद प्रकाश।

दोहरे।

आत्मवृत्ति निर्भद्र करे, आपे तत्व विकाश;  
आत्माने आराम हे, आत्मानंद प्रकाश।

पुस्तक २ ज्ञ. निकम संवत् १९६२—. चैत्र अंक ८ मे.

## प्रभुस्तुति शारूप विकीर्णि।

जे आपे शिवसंपदा सुखकरी कपे दुर्दर्भावली,  
वापे जावि सुग्रीव अतरविषेस्थापे स्वधर्मे वली;  
राणी शीतल छायमां भवतल्ली यावे सदा नामना,  
देवा श्रान्ति इत्पवृत्त जननी पूरी करो डामना। १

शोडिंदगार।

## वसंततिलक।

थेगे कर्या प्रलय डेप इर्या दुःखों,  
राणी नहीं शरभ सल्लितिना सुधर्में;  
हुचा कर्या छरण जैनतयो लुरोपी, १  
श्री भूलयं द्र लड अंधु जतां विवोपी।

१ नहारा इर्मना ऐण्डी. २ सारो राने रोपायेसो— लडायेसो।

१८५

## अपांतमानं ह प्रकाशा.

हैवे द्या दिल धरी न जराय जेयुं,

३, सधि भावनगरे भाविरतन घोयुं;

स्याद्वाद्वनो सरसे कुल लरेल कुट्यो,

डिलो। कठोर जिनसंग॥ तलोन् तुट्यो. २

सधि सुगोध धर आवने गुभांयो,

श्री जैनधित तस्योज हुकाल आ०यो;

घोयो सहायकर जैन महासभाजे,

आभी पडी अभ्यतनीर जतांज आजे. ३

## राहूलविक्षिप्ति.

२३ अंधव सुं अग्नानक कुर्युः २४ चिरा ताढ़ सम्युः?

ज्वतो अहपविचार तें नव उर्यो स्वल्लोकभ्यं शुं गम्युः?

जाइयुं नै सुज भिन अंधव अने संब धिंयो शोचयो,

आत्मानं है सला थता तुज दिना आनं ह संहाययो. १

२५ ज्वतो विधवा अनी तुज वधू नै अकली बंधुरे,

ते साये शुद्ध भजित ने तुज साआ वैधव्य भाभी भरे;

आ०यो आ कलि आल वीरनरनो संहार थाये अति,

छ्वे प्रायङ्ग धर्युं नपुंसक नरो थारो हैवे शी गतिः. २

श्री अहंत अमारी एक अरल्ल सद्व्यानभां स्थापने.

स्वर्गे आषड़ भूलयांद्र नरो धार्ति सल आपने;

थाजे जैनसभाजभां पुनरपि<sup>५</sup> तेवा नरो साहसी, ४

नितये नर्भह निर्भव हृत्यमां ते बंधु रहेने वसी. ५

१. जैन कान्दरन्से. २ आत्मानं ह सभा ३. १ लता-पेसो. ३ प्राये कीरति-  
धर्युं करीने. ४ इरीवार पथ. ५ हिंगतावाला. ६ निवास करीने रहेन्ने.

श्रीकौदमारु

१६७

आत्मानं द सभा च अने आत्मानं द  
 प्रकाशना प्रवर्त्तक वकील मूलयं द-  
 नथुभाष्टिनो स्वर्गवास.

“ कलयति यथा वृद्धिं धर्मः कुकर्महतिक्रमः ।  
 सुखमकुशले न्याये कार्यं तथा पश्चिमत्तम् ”-

विडभ संवत् १६२०ना भागरीर शुद्धक पडवे ने शेज  
 भावनगर ३५४ अग्नमां उद्दित थयेतो एड जैननो प्रधाराभान  
 तारो सवं द १६६१ना यैनभासनी कृष्ण तृतियाने रोज अध्या  
 न्ह झले अस्त थयेतो अह्य समयसुधील प्रेतानी भव्य भुद्धि-  
 अने कृपनानो प्रसाद जैन वायक वृद्धने आपी ए भहान्  
 आत्मा परवेऽवासी थयेतो अनाजवधी समस्त जैन वर्णने  
 अपार घोट पडीछु अनुं यथास्थित वर्णन इत्तते इक्कमे  
 पण यासती नथी. जैन वायक वृद्धने धार्मिक तथा सांसारिक  
 प्राचीन रीति रिथति ओपर इच्छि उत्खनन करावी अब वरतु  
 विचार पुरःसर अवलोकनाने “आत्मानं द प्रकाश” आ ए  
 भहान् आत्माए एड उद्दास प्रथनाभार लयो हुतो पण ए प्रथ-  
 लकु इल जरा पण परिपक्व थलापहेलातंते अने आवेद मांथी  
 यादी जतु पडयु उपाध्यायलु इतःज्ञानसारजेवा गहन अथे-  
 भाने अध्यात्मिक तावज्ञानाना विद्याये गुणस्तेलाङ्गुतो नेभम्भा

૬૬૮

## આતમાનંદ રક્ષણ.

કરી આપવાના “મોધામંત્રો” શ્રીમલચંદ્રાઠનેજ વિદિત હતા અને એ ગંગાનું સતત મનન કરી ભાવ અથ્ય જીવનમાં જે ધ્યાને ભાવના એમણે પ્રત્યે વીજી, તે અનેક વર્ષોઓથી તેમના નિર્મિત નામને ડાયમ રાખશે—એ નિઃસંહેલ હેઠે. આધુનિક ડાલના પ્રભાવથી જૈનોનું જીવન ઉપ જલ પંડથી કલુષિત હોય એ દ્વારાભાવિકછે, અને તે શુદ્ધ કરવાની હિયા એ નિર્દ્દાને ભાગ થાક વખત ઉપરજ આરંભી હતી. પરંતુ એ અર્થે સિદ્ધ થનાને ડેટલોાડ સમય જેઠાં, તે પહેલાંતો આપણું દુર્ભીધ્ય વિજયી નિવણ્યું આત્માનંદ પ્રદાનનો પ્રકાશક આયુધ્ય કર્મના અંતર્ધિતમાં આની ગયો. અતસર્વેશી કાલનું મહાત્મ્ય કૃતાર્થી થયું હતે શુદ્ધબુનું? કર્મ વ્યવસ્થા અગમ્યછે. આ અકર્માત્મ ઘનાવમાં શો ગુપ્ત હેતુ સમાગેલે. હશે એ મનુષ્ય બુદ્ધિ કલીશકે એમ નથી. આપણું ભવિષ્ય એવા આત્માને સાંપ્રી વર્ત્તમાનમાં રહી પ્રાપ્ત કર્તાય કરવાનો શાસ્કડારનો ઉપદેશછે, તો હતે એ નરરતના આત્માને આપણું આત્મામાં જયતે રાખવો અને એ આત્મા જેમ ચડાા પરિણામ તરફ પ્રયાસ કરતો હતો તેમ આપણા આત્માને પણ એજ માર્ગ ચઢાવતો એજ ઉત્તમ માર્ગ છે.

સાંપ્રતિકે વિશ્વનો પ્રલાય કરવા ને દુષ્ટ રૈણ પ્રગટ થયોછે, તે મહારોગ લાય પડતાંજ એ આત્માને આર્હત તત્ત્વજ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો. પંચપરમેષ્ઠી તથા નવપદજ્ઞાના સમરણનો પ્રવાહ તેના દ્વદ્યમાં વહ્યા કરતો

શોકેદગાર.

૧૬૬

અનુભૂતિની પ્રચૂર વિસ્તૃતતા અને જીવનની અનુભૂતિની અનુભૂતિની પ્રચૂર વિસ્તૃતતા

હતો—એમ સમજુ હથયનું સમાધાન કરવું, —એમના વિશાળ અને ગંસીર વિચારોનું મન્ત્ર એજ એમના અપ્તમાનું ઉત્તમોત્તમ રમરણ છે, એમ માની એમણે સુખથી અને દેખથી આપેલા જૈન તત્ત્વજ્ઞાનના અને વ્યવહાર માણિના વિચારો હું કામાં વિચારી જવા,—એટલું જ કર્તાબ્ય રહેલું છે.

શ્રીમાન् ભૂલયંભાઈનો જન્મ સંવત् ૧૯૨૦ ના માગશર શુક્રવારે પડવે ને દિવસે ભાવનગરમાં થયો હતો. તેમનું કુણુંખ ધોલથીયા ના નામથી ભાવનગરમાં આલખાય છે. મરણ સમયે તેમનું વય માત્ર બેંતાળીશ વર્ષનું હતું. આટલું નાતું વય છતાં તેમણે પોતાની જૈન સમુદ્ધાયમાં અને જન મંડળમાં જે ક્રીતિ પ્રસારેલી છે, તે ઉભરથી તેમની નિદ્રાના, વ્યવહાર કાર્યમાં નિપુણતા અને પરમાર્થ પરાયણતા ડલી હતી તે સહજ પ્રાણીત થાય છે. તેમણે પોતાની જન્મ ભૂમિ ભાવનગરમાં પ્રથમ હાઈસ્કુલમાં થતાં મેદિક્યુલેશનના

ધોરણ સુધી અભ્યાસ ચલાવી વકીલાતનો અભ્યાસ પૂરો કરી તેમાં પરીક્ષા આપી ભાવનગરના રાજ્યના પેલા વર્ગના વકીલની સનંદ્ધ પ્રાપ્ત કરી હતી. તે પ્રસંગે વકીલાતને સ્વતંત્ર ધર્યો સ્વીકારી તેમણે જૈન ધર્મને લગતા અથીનો અભ્યાસ શરૂ કર્યો. તે કાલે ભારત વર્ષના પ્રખ્યાત જૈન પંડિત અને આચાર્ય શ્રી આત્મારામજી મહાસજનો સમાગમ થઇ આપ્યો. આ ઉત્તમ પ્રસંગ પ્રાપ્ત થવાથી તેમને પેતાની છાયાનુસાર સંસ્કૃત ભાષાના જ્ઞાનની વૃદ્ધિ કરવા તથા જૈનતત્ત્વ

જીનના ગડન નિષયોમાં અવેલા કરવાની તક લીધી. તે પ્રદેલા જૈન વર્ગની જીજતિના ભાર્ગને દર્શાવનારા સાધનો પ્રગટ કરવાનો તેમનો પ્રથમથીજ ઉત્સાહ હોવાથી ડેટલાએક અલ્યાસ્થો મિચ્ચોનું મંડળ એક્ફું કરી ભાવનગરમાં “શ્રી જૈન ધર્મ-મસારક” નામે એક્સબા તેમણે સ્થાપન કરી. તેમાં પ્રમુખની પદવી ઉપર તેમનીજ પસંદગી કસ્વામાં આવી હતી. ડેટલા એક સમય સુધી એ સભા આવી પણ ડેઈ કારણું સર સ્પર્ધાદ્વારને લીધે તેમનેએ સભામાંથી આપરે જુહું પડતું પછ્યું અને “જૈનહિતેચ્છુ સભા” એવા નામથી તેમણે એક જુહું મંડળ સ્થાપન કર્યું. આ મંડળમાં તેમના ઉત્સાહ અને સદ્ગ્રાહ નિવેરે ગુણોથી ધર્મા સમય વર્ગને એટલો મેધા ખમાડયો હતો કે ડેટલાએક ધાર્મ તથા તરદદિશ આવડા તેમની આસે અલ્યાસ્ઠ કરવા તથા તેમનો સદ્ગ્રાહ અવણું કરવા આડર્શીયા હતો. કેમાં ભરણું ભી. વીરચંદ નાથકુળ ગાંધી ભી. એ. મુખ્ય હતા. અહેવ સમયમાંજ એ સભા જાત્રત થઈ અને “જૈનહિતેચ્છુ” એવા નામથી એક ભાસિક ધર્મ પ્રગટ કરવા લાગી. કેમાં ભરણુંમના બોધક લેખ પ્રગટ ધર્મ વા લાગ્યા એ કાર્યના સહાયક ભી. વીરચંદ રામનાનું જૈનવર્ગની ધાર્મિક ઉત્તતિ કરવા ઈજલાડ જવું પડતાં ત્યાં તેઓ તેમને સેંપ્રવામાં આવેલ ધાર્મિક કાર્ય કરી એરીસદ્ર એટ લોની પરિકામાં પ્રસાર થયો અને ભરણુંમના પિતાશીને વૃદ્ધિનું પ્રાપ્ત થતાં વૃદ્ધુંયત્વાનારની સર્વ ધૂરા શ્રી મૂલચંદ લાઈના થિત ઉપર આવી પડી તે

## શોકાદગાર.

૨૭૧

સાથે તેમના લખુણંધુ ભાઈ હરિયંદ્રને એરીસ્ટર નો અભ્યાસ કરવને માટે છંગલાંડ મોડલવા પ્રથમ પગનું ભરવા તેમની ઈચ્છા થઈ, ઈત્યારી વ્યવહારની ગઢનતામાં તેઓ ગુંજાઈ ગયા— તેથી જૈનહિતેઝુ માસીડ નો પ્રવાહ તુટી ગયો. તથાપિ તેઓએ સ્થાપેલી સભાનું જીવન એમતું એમ ટકાવી રાખ્યું. પેતાના લખુણંધુ મી. હરિયંદ્ર છંગલાંડમાં આગળ વદ્યા અને અરહુમનો ભગીરથ પ્રયત્ન ઇલોન્સુખ થવા આંદોલન— એરીસ્ટર એટ દોની. પરિક્ષામાં પસાર થયા પરંતુ મનુષ્યનો પ્રયત્ન ગમે તેમ છાંઠાં કર્મગતિ કાંઈ અન્યથા હતી. એટલે આ સમયમાં તેમના એ લખુણંધુ મી. હરિયંદ્રનો છંગલાંડમાં અકસ્માત સર્વીવાસ થયો.

આ મહાન્ હાની થઈ અને તેમને પેતાને પણ વ્યવહાર પણ ઘણું હાની થઈ. આવી સ્થિતિમાં પેતે ઘારેલી ધારણા નિષ્ઠલ થવાને લીધે તેઓ તે મહાન્ શોકથી શૂન્ય થઈ ગયા.

આવી સંકષ્ટ ઘારેલી સ્થિતિમાં તેઓ આંદોલન કરતા, તાંત્રિ તેમના નિર્ભિલ હૃદયગાં ગુરુ જહિંગે સંજગ્રહ વાસ કરેલો હતો, મહોપકારી ગહાસુનિ આર્યા શ્રી આત્મારામજી મહા રાજના ચરણ ઉમલતું ધ્યાન તેઓ સર્વીદી કરતા હતા. એ ઉપકારી ગુરુનું જન સમૂહમાં દ્વારણ રાખવાને સંવત ૧૬૫૨ ના બીજ જેઠ માસની શુક્લ દ્વિતીયાને દિવસે ભાવનગરમાં “શ્રી આત્મારામજી જૈન પુસ્તકાલય” ની તેમણે સ્થાપના કરી હતી. અને તે સાથે પૂર્વોક્ત સભાનું જીવન તેઓ જલવતા હતા.

૨૭૨

આતમાનં પ્રકાશો

જૈન સમુહને લાલ-કારક થાત તે બંધુ પડેલું જોઈ,

તે કર્યે કરવા તેમની ઘુણ્ણી મેરાધ. અને પોતાનું જૈન તત્ત્વનું જ્ઞાન પ્રસાર કરવા મર્ગું ગુરુનાની આત્મારામજી મહારાજના હિંદુરતાની ભાષામાં બનાનેલા શ્રી જૈન તત્ત્વાર્થનું ગુજરાતી વાચકવર્ગ વધારે લાલલધ શરૂ તેવા હેતુથી રેલું શુદ્ધ ગુજરાતી ભાષાંતર ને એથે વણેજ અમ કર્યું કે ચાચ ચાચારે મેળું છે અને જૈન ડામમાં તે હોશથી વંચાયછે તેમજ :—

જેનોના ચૃઢું-ધર્મ અને સાહિત્યનું નિરેયન કરવા તથા જૈન તત્ત્વનું તથા ન્યાયનું જ્ઞાન પ્રસાર કરવા “આત્માનંપ્રકાશ” નામનું માસિક પત્ર પ્રગટ કરવા માંડ્યું. જે પત્રને શ્રી આત્મારામજી મહારાજના પરિવારના સુનિમંડલે તથા જૈન વર્ગનાનિદ્વાનું ચૃઢુસ્થોચે અતુમોહન આયેયું. બેજ વર્ષના ખાલ માસિકને અત્યારે તેમના લેણનો ગણનું વિષમ વિશોગ પ્રાપ્ત થયો— એ ડેઢલી હાનિ !

ત્યારપણી તેમની જીતમ પુરતડો લખવાની છાંઢા થવાથી તેમણે જૈન લંડારેનો શોધ કરી તેમાંથી ચોણ્ય પુરતડાના ભાષાંતર કરી પ્રસિદ્ધ કરવામાટે પ્રયાસ કર્યો કે ડામમાં તેમણે ભાવનગર હાઇર્સ્કુલના શાસ્ત્રી નર્મદાશાંકર દામોહરને સહાયક તરીકે પોતાની પાસેરાખ્યા હતા. તેમાં તેઓએ ને ડામ કરેલેછે, તે પ્રતિમારાતક, ભરખાહુ સંહિતા, પૂજા સંચાહના ચાર લાગ અને આનંદ ધનજી બોંધોતેરીના:

શાકોદગાર.

૨૦૩

અર્થ વિગેર પ્રયિષ્ઠ થયેતા પુસ્તકાની નોંધ જોવાથી સહજ  
જોવામાં આવે તેમ છે. ગુજરાતી ભાષા સાથે જૈનરીલીતું  
તેમનું અનન્યજ્ઞાન અને તેનો સારોદ્ધાર કરવાની તેમની  
જિજ્ઞાસા ડેટલી હતી તે આજ કહેવાની જરૂર રહેતી નથી.  
જૈનરાલાએમાં ચાલતા પુસ્તકાણાં શી ખાસી છે અને જૈન  
શીક્ષાના ધોરણું ડેવા હોવા જેણે તેનો નસુનો તેઓ જૈનોના  
સાક્ષરવર્ગ સર્વીય પ્રસંગેપાત સુદૂરા હતા. જે નસુનો ભાગરેળ  
વાલા મુંબદના પ્રભ્યાત પ્રહૃદ્ય ભી. અમરચંહ તલકંચ દાદી  
જૈન સીરીઝના સંચાહમાં હુસ્તાક્ષરના લેખથી આપેલો છે.  
સંસ્કૃત ભાષાના પુસ્તકો ને જૈનરીલીમાં સુફ્ફાની તેમની  
શક્તિ અને તત્ત્વજ્ઞાનની ભાષામાં અસ્ત્રથંથ રચવાની તેમની  
ચોંઘતા ધરે સ્થળે પ્રગટ થયેલી છે, અને તેમની સર્વમાણી  
બુદ્ધિ સ્વતંત્ર લેખો લખવા માટે પણ તેટલીજ તત્પર હતી.  
મુંબદના અને વડોદરામાં ભણેલી જૈન કોન્ફરન્સ વખતે  
તેમણે બજારેલી સાધમીબંધુએની સેવા અને વિષયક મીટીમાં  
કરેલા કાર્યથી ડેટલાએક જૈન નિદ્રાનોના અને પ્રહસ્યાના  
મન પણ પોતાની પ્રત્યે આડાર્યો હતા. સારાંસ એટલો કે  
તેમણે પોતાની આટલી નાની વયમાં એટલા બંધુ જીમ  
કરેલાછે કે તે ગણુના ઐસતાં વેખતો નિસ્તાર થઇ જય.

આશિનાય તેઓ સંગીત કલાના સારા અભ્યાસી હતા.  
જિનાલયમાં જ્યારે તેઓ પૂજા લણાવતાં ત્યારે તેમની કંઈ  
માધુરી સહિત અંકિત ભાવના જેજ લવિક આતાએ જિન્નત અને  
પ્રથમ રસતા તરંગાથી જિલ્લાર્થ જતા હતા. વક્તા તરીકે

તેઓ ધર્મિવાર સારું કામ કરતાં અને સ્થાદ્વાદ દર્શિનના સૂક્મ સ્વરૂપને દૃષ્ટાંત સિદ્ધાંતથી પ્રત્યક્ષ કરી જનસમૂહની આગળ દર્શાવી શકતા હતા. વાદવિવાદમાં તેઓની શક્તિ ધર્મી જીતમ હતી. અરા અતઃ કરણથી જૈન સિદ્ધાંતનો ડાંડ ઉપાડનાર એ સમર્થ વિદ્વાનના હૃદયમાં ધર્માલિમાન એવું અમત થતું કે જેની પ્રતિલાની પ્રસા આગલ વાગી ક્ષણવારમાં નિસ્તેજ થઈ જતો હતો. તે સાથે તેખલામાં ધર્માલિમાનના ઉંચા પ્રકારની હતી તેમની વિચાર મુદ્રામાં સંબંધ સર્વદા ધર્મ કાર્યની સાથે નિશેષ રહેતો હતો. તેઓ ઉપાધ્યાયજીના જ્ઞાનસારનું સર્વદા મનત કરતા હતા. તેમનો સંગીતમય આત્મા જૈન કાળ્યોના સંગીતથી જોણે પરમાત્માનું દર્શિન લેતો હોય, તેમ તે પ્રસંગે તહીલીન થઇ જાલો હતો. બાઇયતત્વને અનુભવી આંતર તત્ત્વોના સ્વરૂપને અવલોકન કરબાનું દ્રષ્ટાંત તેઓ દર્શાવી શકતા હતા. જે અમની યુદ્ધિની વિચાલતા અને વિચાર શીલતાનો હેઠળનો પુષ્ટ હતો. સંસારનું મોહુમય સ્વરૂપ તેઓ સમજતાં તથાપિ એ મોહુથી આત્માને જુદો કરી શકતા નહતા. શરીર ઇપ વૃક્ષનો લંઘ થકાનો તેમને મોટો ભાગ હતો, અને તેને અસાર ઇપે તે સમજતા પણ હતા લેમજ નિત્યની આવરશક ડિયામાં તેઓ મુખ્ય પણે સમાધિપુર્વેક સામાયિક લાલ પરમાત્માની લક્ષ્ણ કરતાં અને તે પ્રસંગે તત્ત્વ જ્ઞાનનો સ્વાધ્યાય કરી અન્ય ને ઉપહેઠ આપતા હતા સામાયિક ડિયાને તેઓ મોહું માનાયા પતા અને તે શુલ્ષ સમયનો લાલ આપવાને આત્માનંદ સભાની જાથે એક “ સામાયિક શાલા ” તેમણે સ્થાપન કરેલી હતી.

शोकेशगारु

२०५४

महावीरजी का जन्म और मरण के बारे में विवरण तथा उपकारण।

तेभनामां इतशतानो शुणु उत्तम हतो। अन्यनां उपकारने  
तेच्चा लुली जता नहता ते साथे अन्यने इः ऐ लेछ तेभनुं  
हृदय आर्द्ध थध जतुं हतुं। अनेक तत्त्वाल तेवा अनन्ती सहाये  
करवा तेच्चा तत्पर थता हता। मुनिच्चोऽयथार्थ मुनिवर्ण  
लेछ तेच्चा हृदयमां हृषि पामता अनेक तेवा मुनिच्चोऽतद्द  
प्राप्तानी शुद्ध भक्ति, ईर्षावता हताएँ प्रभुभर्थी के अस्यार्थ श्री  
विज्ञानाद्यसूरिना तेच्चा अस भक्ता हता, तथापि विशेषभवि-  
चित मुनिवर्ण श्री वृद्धिचंक्रम भद्राजना शुणु लेई तेच्चा  
तेभनी प्रशंसा करता अनेक तेभना पशु उपकारने सर्वदा सभ-  
रणु करता हता।

आवा नरनुं आ हुनियाभार्थी प्रयाणु थयुं सांखली  
तेभना परोक्ष अथवा अपरोक्ष परिव्ययमां आवेल किया भनु  
ध्यने घेह थया विना नहीं रहे। भारत भूभिमां वसता जैनोमां  
धन सभृद्धिवाला पुरुषो धणुं हरे पणु जे ज्ञान सभृद्धिवाला  
योडा नर उत्पन्न थयाछे अनेक थरो तेभनी साथे गणनामां  
मुक्तवा योऽथ आ सौराष्ट्र देशने। उत्तम नर आटली युवाव-  
स्थामां गत थवाथी सर्व जैन वर्गने हानि थधछे, एम इही  
शुं तो तेभां कांध पशु अतिशयैक्ति, नक्षी, तेभना विआर-  
हं भेशा अति उत्कृष्ट हता अनेक तेभां अग्नुं खदुं सामर्थ्य-  
हतुं डे ते प्रभाषे ते धर्मां भोटा भासने अरेभरी  
आपतमां प्राप्तानी पाछल दोरी जता। आवा तु पुरुष  
रत्ननी आभी अंडा अंडा पुराया। एह अनन्तुं कठि-  
णुछे, तेभना भिन्न अंडलभां, जैन वर्णता साक्षर

૨૦૬

## આતમાનંદ પ્રકાશ.

સત્તાના જીવનની વિધાનોનું મનુષ્યની જીવનની વિધાનોનું હોય

મંડલમાં અને દેશના નિદ્રનસંડલમાં તેમની જગો ખાલી ખરી ગઈછે. આ વાતનો શોક તે તે હર્જના લોકો કરે તે સેવા લાનિકાયે. દ્વારા પણ વિશેપ એંઝે કારક એ છે કે તેમના કૃદ્ધ માતુશ્રી વિવભાનથે અને ખાલી પુત્ર તથા પુત્રી સહિત તરણ વિધવાછે, તેમને માણે આની પડેલી આ વિપર્ચિના શોકમાં અમે અંતઃકરણ પુર્વક લાગ લઈએ છીએ.

એ વીરનરની મોટામાં મોટી ઘોટ આ આત્માનંદ સભાને આની પડીછે. એક અંથકાર અને ઉત્તમ પ્રતર્સદ એવા વોર નાયકને સભાએ શુભાંગોછે. ભર સમુદ્રમાં આવેલી નાનિકાએ એક અતુર ખલાસી ઘોયોછે. પછ્ચાં એ ભવ્ય મૂર્તિના દર્શનનો યવાના નથી ભાવ તેના અંતરાત્માના આ દર્શન વેવા વિચારો અમારા દૃદ્ધયમાં પ્રતિભિંગિત છે. એ પ્રેમ ભર્યું દૃદ્ધ, એ શુરૂ ભક્તિની ભાવના, એ અશાંત, ઉત્ત્ર પ્રભાવ, વાલી બુદ્ધિ, એ ધર્માભિભાન, એ ઉત્સાહ અને એ સામર્થ્ય—ને કાણુનાર પણ વિસરી રાકતા નથી. તે એકજ પુરુષ હતો તેની ઉપમા તેજ હતો. જે આજ અસ્ત થઈ ગયો જે નિરાશાના અસર્પય મોઝાંથી વીંદ્યાંગોંઠાં પણ આશાના ખડક ડિપર કથ નિશ્ચયથી સલભી ઉન્નત પ્રયાણને અનુકૂલ સ્વરૈ ગાતો, જ્ઞાનબીર એ હુવેનથી એના સાક્ષર જીવનનો જે આદ્ય ઉદ્ગાર હતો મધ્યે પણું જે ઉદ્ગાર ૬૬ રહ્યો હતો તે અત સમયે પણ તે ઉદ્ગારથી તેનો કંઠ ભરપુર હતો. જેમાં જ્ઞાનસારની તત્ત્વજ્ઞાની ઉચ્ચરતાં પંચપદ્મેષીના શરણનું જ સમાપ્ત પુર્વક સમરણ હતું. એ પવિત્ર દસ્તખ્યું તેના આત્માને પરમ સાંત્વિ આપો.

चिंताभृती.

૨૬૭

## चिंताभृती.

એક અમલકારી વાર્તા.

( પૂર્વ અંદના પૃષ્ઠા ૧૭૬ થી ૧૮૮.)

પ્રકરણ ૮ મુદ્રા.

વર્દ્ધમાન પુરનો જીપાત્રય એડ સાધારણ નિવાસ સ્થાન જેવો હતો. તેની અંદર એડ તરફ વ્યાખ્યાન શાલા આવેલી હતી. એક તરફ સુનિશ્ચાને આહાર પાણી કરવાનું સ્થાન હતું. તેનો જિહાવ નારો હતો. ડાંડાગુ જીપર માત્ર હતો નહિ. વાસસ્થાન કરતાં આંગણાની ભૂમી વિશાળ હતી. વ્યાખ્યાન શાલામાં ડાઇવાર લોડાન સમાતો ત્યારે નન્દો તેના આંગણામાં યેસતું હતા. તેની અંદર પથ્થર કે છાથી પ્રલિઘ્ન ભૂમી ન હતી. માત્ર સાહી ભૂમી હતી તે જીપર કેમલ અને કેતરાં ભની રેતી પાથરવામાં આવી હતી એડને જીપાત્રયનો સર્વ હેખાવ સાધારણ અને સાહી હતો. તથાપિ ત્યાં સાધુઓની સર્વ જતની સગવડ. કરવામાં આવી હતી ચોતરફ સ્વર્ણચાતા દીપી. નીકલતી હતી. તેને સ્વર્ણ રાખતાને વર્દ્ધમાનપુરના ગરીબ આવડા તત્પર રહેતા હતા.

પરમસાધ્વી નિધાશ્રી સુનિતે વંદના કરવાને આ જીપાત્રયમને આંગણા. સુનિ વિચાર વિજ્ય સ્થાંદિલ જવાને બાહેર ગયા હતા. એકલાજ ચંદ્રવિજ્ય જીપાત્રયને અલાંકૃત કરતી હતા. સાધીશ્રી એ આવી સુનિરાજના દર્શન કર્યા. ધર્મિયાગથી સ્વર્ધમ્બ પ્રમાણે નિધિ રહિત વંદના કરી. સુનિએ નિધિના યોગ્ય વચ્ચનો જીવાર્તા સાધીની વંદનાનો સ્વીકાર કર્યો. પરસ્પર સુખથાતું પુછચુણાં આવી.

२०८

## આત્માનંદ પ્રકાશ.

યં દ્વિજયનો સુનિવેશ તેના પૂર્વિકુણે આચ્છાદન કરે તેવો હતો  
તથાપિ ચતુર સાધીએ તેમના ફર્ણ કરતાં પોતાના પૂર્વિધુ  
ચિત્તામણિલું સમરણ થથ આવ્યું. પૂર્વના પરિચિતખંડુની આકૃતિ  
તેમના નયનની આગળ ઘડી થઈ. તેમની સમક્ષ સહેદર બંધુનેં  
સંખંધ જાયત થયો. સાધી વિદ્યાશ્રીએ હૃદયમાં વિચાર્યું કે, આ  
મુની મારો પૂર્વિધુ ચિત્તામણિ તેનહી ઢાયણ સૂક્ષ્મદર્શિએ જોતાં એ  
બંધુના સર્વ જ્ઞાન ભલતા આવેછે. જો મારો તર્ક સત્ય ઢાય તો પૂર્વના  
માતપિતાનું લુણ સુધ્યાર્થું કહેનાય. જે કુલમાં ચારિત્રનો આદર થાય  
અને પરમ પવિત્ર મુલિ લુણ સંપોદન થાય, તે કુલ જ્ઞાનક કુલમાં  
શિરોમણિ છે. આ મુનિની આગજા સર્વ જેઠ ખુલ્લા કરવાને સંસારી  
પ્રક્રિયા કરવા તે મારા સાધીધર્મની વિરુદ્ધ છે. તથાપિ શુલ પરિણામ  
રાખી યુક્તિ પૂર્વક તે અંતલેદ ઓલાય તો મારા આત્માને શાંતિ  
મળે. આ પ્રમેણ શુલ ધરાદાથી કરવાના છે. તેમજ તેમાં ચારિત્રતી  
જાતમ અનુમોદના રહેલીછે.

આંદું વિચારી સાધીશ્રી વિનથથી બોલ્યા—મુનિરાજ, ત્યાંથી  
નિહાર કરી પધાર્યાછો? અને કયાં જવાની ધારણાએ? યં દ્વિજય  
મુખ લખિકાની જતના કરી બોલ્યા—સાધીએ, સૈચાષ દેશમાંજ  
અમારો નિહાર છે. હવે ક્ષેત્ર સ્પર્શીના ઢાય ત્યાં ધારણાછે. સંવિગ્રહ  
મુનિરાજના સુખમાંથી આટલા શખ્ઝો સાભસતાંજ વિદ્યાશ્રીને નિશ્ચય  
થયોડ આ ચિત્તામણિછે; શણા જાલના પૂર્વ સહેવાસથી તે ચતુર  
સાધીએ પૂર્વના બંધુનો સ્વર જ્ઞાનાખી લીધે તેમના પવિત્ર હૃદયમાં  
શાંતિ સુધ્યાનું સિંચન થયું. ખુલાં પ્રશ્ન કર્યો—મુનિરાજ, ડાર્ઢવાર  
વલભીપુર વરસ્ય નિહાર કર્યો છે. ડાર્ઢહિ કે તે ક્ષેત્ર મુનિસ્યેમાં વિ-

## વિંતરમણી.

૩૬૮

જારને યોગ્ય છે, ત્યાં ધર્માં ગુરુભક્ત આવડા રહે છે, આપે ડાઈવાર વલ્લભીપુર જ્યેથે કે નહીં ? ત્યાં અમૃતયંત્ર શેઠ કરીતે સારા આવક રહેછે, તેમને આપ ચોલખોળે કે નહીં ?

અતુર સાધીના આપ્રેસા સાંસલી મુનિયંત્રનાન્ય વિચારમાં પડયા આ સાધી જરૂર મારા પુર્વ સંબંધને જણે છે, રામેને મારી સંસારી એન જતનાતો નહીં હોય. વયચને સ્વર મલતા આવેછે, આકૃતિ પણ તેના જેવી હશે સ્વીચ્છાની સામે દ્રષ્ટી સિથર કરી તેની આકૃતિ નીરખવી એ મુનિનો ધર્મ નથી, જે હું ખરાખર નિરીક્ષણ કરું તો આકૃતિ પણ જણાઈ આપે પણ ધર્મ વિરુદ્ધ પ્રવર્તન ન કરું જતનાએ ચારિત્ર અહંક કરેસું છે. વિધાશ્રી એવા નામધીતે વિખ્યાતછે, આવું વિચારી મુનિએ સાધીને કહું સાધીજ તમારા પ્રશ્નો ધર્માં ગંભીરછે. તમે આ શરીરના જ્ઞાતા હો એમ લાગે છે, તમારા ચાતુર્ય અરેલા પ્રશ્નોથી હું વિર્મશમાં પડ્યોછું હરૈક પ્રક્રના ઉત્તર મારેસત્ય આપના જોઇએ મુનિને મૃખાવાદ યોલોએ અનુચિતછે, જે હું ધર્માર્થ કહું તો પુર્વના સાંસારિક લાવને પ્રગટ કરવાની ઇરજ પડે છે, તે પેહેલા મારે તમને થોડુક મૂછવાતું છે. તમે કારાંથી વિહાર કરી આવોછોઃ અને 'તમારું' ચારિત્રાવસ્થાનું શું નામહે મુનિયંત્ર વિજ્ઞયના આ એ પ્રક્રસાંસલી વિહુપી સાધી એ અહંક કે જરૂર એ મુનિના મનમાં હાંઈક શંકા ઉત્પન્ન થઈ. તેમના દૃદ્યમાં પોતાનું સાંસારિક સ્વરૂપ પ્રગટ કરવાની દર્શા નથી તે છતાં તેઓને મારા પ્રશ્નો, પ્રગટ કરવાની જરૂર પડી હોય તેમ હેખાયું વળી તેઓએ મને જે પ્રક્ર કર્યો તે પણ તેમના દૃદ્યની શંકાને વિશેષ પુષ્ટિ આપે છે જરૂર એ મુનિચિંતામણી છે.

૩૧૦

## આનંદ પ્રથાશ.

હવે હથ્ય નિશ્ચયપર આત્મતુ જામ છે. આવુ વિચારી સાંદર્ભાશ્રી બોલ્યો—મહારાજ હુ રાજનગર પારક્ષથી વિહાર કરી આલુંછુ, મારું નામ ગુરુએ વિદ્ધાશ્રી રાખ્યું છે.

વિદ્ધા સાંદર્ભીના ચા વચન સાંભળી વૈભવ વિજય ને નિશ્ચય થયો છે, આ મારી મૂવની સંસારી યેન જતનાખ છે. તે ગતિન ચિંતાએ ચારિત્ર લઈ માનવ જીવને સુધાર્યો છે. તેના ક્ષી જીવનને જાચ્ય સિદ્ધિમાં મુશ્યું છે. આજે જતનાને ચારિત્ર ધારિણી જેથી મને પૂર્ણ જીતોથી થાય છે. તારુણ્ય વયમાં ક્ષીએને વૈભજ્ય હુઃખ દ્વારા સાગરને તરવાનું દૃઢનાર ચારિત્ર છે. ચારિત્ર દ્વારા સુંદર નાવમાં ઘેડલી વિભવા નારી જવસાગરને શુભે તરી જાપ છે. વનિતાએ નાવપુમાં પ્રાયે કરીને નિશેષ નિકાર હોયછે. તેના વિષમ નિકારનો વિજય કરવાનું મુખ્ય સાંદર્ભ ચારિત્રજ છે. તેમાં વિશેષ કરી હુઃખી વિધવાએને તો તે જીતમ આધાર થઈ પડેછે. સાંધી વતનું શરણ કરવારી વિધવાએ વિષયનો પરાભવ કરી સુખે આત્મ સાંદર્ભ કરી શકે. યેન યતનાએ તેવા ચારિત્રને લઈ પિતૃકુલ અને ક્ષસુરકૂલને સુધાર્યું છે.

આવો વિચાર કરી મુનિ વૈભવ વિજય બોલ્યા—સાંધીજી, તમે પુછેલા પ્રશ્નનો જીતાર વિશેષ વિનેચનથી આપવામાં મને ખાદ આવેછે. તે પ્રશ્નનો જીતારમાં મારા સંસારનું સ્વરૂપ પ્રગટ કરવાનો પ્રસંગ આવેછે. સાંસારિક સ્થિતિને પ્રગટ કરવી એ સુની ધર્મની વિરુદ્ધ છે. સંક્ષેપમાં એઠલું જ કહેવાનું છે, તમે જે પુછ્યું, તે મારે પૂર્ણ સર્વદા પરિચિત છે. એ ક્ષેત્રમાં આ શરીરની પૂર્વ સ્થિતિનો પૂર્ણ સંબંધ છે. હવે તે વિષે વિશેષ કહેવાની આવશ્યકતા નથી.

## चिंताभिष्ठि.

२११

वली हुं विशेषमां जथातुं छुं के, तभारा थरीरनी पशु ए क्षेत्र  
 भूमी चरिचित होय एम लागेहे. भारा आ विचारमां जे लुल  
 होय तो अिथ्या हुळृत छे. बैलव विश्वयना आवा गर्लित वचन  
 सांखली साध्वी विधाशाने निश्चय थयो के, आ मुनिराज जडूर भारा  
 संसारी खंधु चिंताभिष्ठि छे. जे भ मे तेआने आवाप्ती लीधा,  
 तेम देओए पशु भने जाली लीधीछे. हवे विशेष रपण्टुकरवाथी  
 चारित्र धर्मने खाध आवशे, भाटे ते विषे कांहपशु घोलतुं लिचित  
 नथी. थयेली शंडातुं सारीदीते सभाधान थई चुक्कुं छे. भारा  
 खंधुचे चारित्र लध स्वनं थने दीपावली छे. संसारना भातापिताना  
 आवक्ष धर्मने कृतार्थ इर्याछे. हवे भने पूर्ण सतोष थायछे 'चिंताभिष्ठि  
 स्वशुद्ध छाडी आवयो गयो' एतुं ज्यारे पूर्वे मे सांखल्युं हतुं,  
 त्यारे संसारना संख्यने लध भने विशेष चिंता थध पडी हती.  
 ते भारी चिंता आजे अडसमात् दूर थधछे. चिंताभिष्ठिना चारित्र  
 युक्त दर्शन करी मे भारे साध्वी धर्म चरितार्थ कर्त्त्वे छे. आजनो  
 दिवस भारे सर्वथी विशेष लालहायक थयोछे. आतुं चिंतनी विधा  
 शीअ आनंदना आनेशमां दूरीवार भक्तिथी चिंताभिष्ठिने वंदना  
 करी ए परम पवित्र साध्वीचे पोताना सहेदर खंधुनो विशेष  
 ज्ञानग्रन्थ कर्त्त्वी गति डवी निचित्र छे. क्यां वहूसीपुरा क्यां  
 राजनगरा क्यां वहूमानपुरा भाता अने भगिनीनो क्यां अन्यानक  
 भेदाप? संयोग अने वियोगना कारण कर्म छे. अत्यारे वहूसी-  
 पुरमां अमृतत्यं द्र सेठ क्षेत्रे क्षेत्रे चिंताभिष्ठिनी चिंतामां मग्न छे,  
 अमृत रोठाणी पशु पोताना पुनरे हत्यमांथी लुली नथी विभवा  
 परम श्राविका छे, तथापि डाढवार पोताना पतिने रमरण मार्गमां

२१२

## आरम्भानंद उक्तिश.

कानेछे. ते चिंताभणि आजे वर्षभानपुस्ता जीपाश्रयभां भुनिहो रहेलछे. तेनी पासे अडोहर येन साध्वी इपे वांडना उरेछे. अमृत-चंद्र शोडना भुन अने पुनरी आरित्तना जीपासड थड्याई आवासभां बेहाले. कर्मनी उवी भङ्गान् शक्ति?

भुनी चंद्रविजय अमे साध्वी विद्याश्री जीभरनी चर्चा अधीक्षी धर्माल्लासार अडी वीलनी सामु नेह रक्षा हुता. तमने आरित्त धर्मना परभ जीपासड हुता. आरित्त धर्मथी विहङ्क वर्तन उरवाने भीड हुता. संसारना संबंधने लर्ड जीभयभां असेक विद्यारो जीह-भवता हुता भशु तेच्या भिथ्या हुष्टु आभी तेमतु विसभश्यु उरता हुता आ वर्खते भुनिशज्ज शीभियार्विजय बाहेरथी भधार्या. तेमने आवता जेह भुनी चंद्रविजय विनयथी जीला थया. अटले साध्वी विद्याश्री भणु जीला अधी तेमने वाढना उरता आप्या.

अपूर्ण.

## अस्त्रयर्थ प्रखाव.

नर्मदा सुदर्शी.

( गत अडेना पृष्ठ ५८३ थी याहु. )

इषिदत्ताच्च भेताना स्वाभी उद्रदत्तसे इब्बु, स्वाभी तमे तभारा पुन भडेक्षरदत्तने भाटे नर्मदासु दरीनी धम्पत्ता शाखोछे. ते वृथाछे. मारे लाई सहहेव अदेख्ये आवड छे. कैन धर्मनो अतिरागीछे. ते तमने भिथ्यात्तीने वेर पोतानी पुनरी हेम आपरो नदीभारे तमने

## અધ્યાત્મિક અભાવ.

૨૩

એદ સાથે જણાવવું જોઈએ છીએ તે તમે કબે આવક અતી મારા પિતાને છેતર્યાછે. તે ધણું વિપરીત કર્મ ડર્યું છે. શુદ્ધ શ્રાવક કુલની કન્યાને ઈપટથી કલાકિત કરવી એકેવું પાખ તમે એ પાય. ઈપ ખંડથી અરડાચેતાએ. સ્વામીતાથ તે સાથે વલી એવું ઘણું હે, તામારા સહજાસથી મેં મારા પિતુ કુલનો શ્રાવક ધર્મ તળ્ળાદીયો એ વાતા મારા પિતુ ગુહમાં અસિદ્ધ થઈછે. આથી એ સર્વતો મારી ઉપર અભાવ આંદેછે. એ અભાવ મારા જણાતામાં આવતા મને અસાદ શોક થયો હતો જે શોક કરતાં તમે મને હમણા જોઈ હતી, સ્વામીતાથ કર્મતી ગતિ વિચિત્રાંશે. લાવિમાં જે થવાનું છે, તે કહ્યા પણ કુલનું નથી. તેનો જેઠલો અદ્ભુત કરીએ તેઠો વૃથાએ હું એક વખતે પરમ શ્રાવિકા હતી. ઉપાશ્રયમાં જ્યારે આવતી ત્યારે ઉત્તમ કુલની શ્રાવિકાએ મને મેદું માન આપતી હતી. શ્રાવિકા ધર્મની ઉત્તમમાં હતમ. ઉપાસક હતી. તે આને મિથ્યાત્વમાં મળન. થદ બેઠીછું અદ્ભુતનું નહીં. પણ આર્દ્ધત ધર્મથી બ્રાહ્મ થદ સ્વામી મને ધણેલ પ્રશ્નતાપ થાય છે. તે સાથે મારા પિતુ ગુહનો ત્યાગ કરવાની મને ક્રાજ પડી છે. હું હવે પિતુ ગુહમાં જવાને અધિકારી નથી. ડાર્ઢ પણ શ્રાવક કુલનું સેંતાન મારો સર્વરી. કરવાથી પણ અપવિત્ર થાય એવું મહા કલાક મને લાગ્યું છે. હમણાનું એક પુરુષે આવી મને માદા અખર આપ્યાછે; તેણે ખુલ્લો ખુલ્લું જણાયું છે. એ ધર્મ ભાષ્ય રૂપિદાતાએ તેનાપિતુ ગુહમાં જવું નહીં. સ્વામી આવીસિત તિરસકાર પામેલી રૂપિદાતાના પુત્રને મારેપુભાઈ સહદેશ પોતાની કન્યાએ સી રીતિ આપેલ.

રૂપિદાતાના આવા વચ્ચા સાંભળી રૂપદારા કાઈ બોલ્યો નહીં.

૨૧૪

## આતમાનં પ્રકાશ.

પોતે પ્રથમ કરેલા કૃપયાયારનો વિચાર કરતાં તેને નિશ્ચય થયો કે સહુદેન કદિ પણ મહેશ્વરદાતને કન્યા ન્યાપરો નહીં ક્ષણનારે મહેશ્વરદાત વિચારકરી બોલ્યો—માતા ભને : હેઠાને લજાતો આતે પણ મારે પ્રગટ રીતે કહેકું લેઈએ ડે, જે નને આજ્ઞા આપો તો કું એકાર મારા મેશાલમાં જઈ આવું ભને ખાની છે કે, મારા મેશાલીઓ હું મસનું ફરી શશીયા વાણીની મધુરતાથી સર્વત્રી સાથે સુવાસથી અને વિનયથી એ લોકું મારે વશ થઈ જશે. માતા હું નિધ્યાત્મીમાં જન્મ્યોછું પણ મેશાલપણે જૈનછું શાખાટે તેઓ ભને આદર નહીં આપે કદિયાર્થી ઉપાસક એવા મારા મામા સહુદેન મારો તિરદારકરશે નહીં. હું તેમનો રનેહ જોઈધશ્યોકાલ તેમના સહવાસમાં રહીશ અને છેવટે ભાતુલ પુની નર્મદાસું દરીને પરખીલાવીશ.

મહેશ્વરદાતના આવા વચ્ચન સાંભળી રૂપિદાતાનું મન જરાશાંત થયું. પોતાના પુત્રના વિચારને તેણીએ અનુમોદન આપ્યું અને ત્યાં જવાને અંતઃકરણુથી જુશી ખતાવી ભાતાની મરજી જોઈ મહેશ્વરદાતે પિતાની પણ આજ્ઞા મેળવી અને તે વળતા જતે તૈયાર થઈ ગયો. માર્ગે જવાની સર્વ સાભારી તૈયાર કરાવી જ્યારે મહેશ્વરદાત આદ્યો ત્યારે રૂપિદાતાએ કહ્યું, વત્સ, તું સર્વ રીતે યોગ્યછું તને વિરોધ કહેવાની ફાંઝ જરૂર નથી તથાપિ જેમ તારા ભાતામહુ, મા, મામા, અને ભાભી અનુકૂલ થાય તેમ વર્તને. તેમની નિર્દ્દ કાંઈ પણ પ્રવર્તન કરીશ નહીં. ભને રાડ રહેછે ડે મેં કરેલા અપરાધને લઈ તેઓ વંઘતે તારો અનાદર કરશે કદિ તેવો પ્રસંગ ભનેતો ઢાપ કરીય નહીં. ત્યાંથી સતતર પાછો આવને, તારો વિજય થાઓ આ પ્રભાષ્યે રૂપિદાતાનો ઉપરેણ અને આશીર્વાદ લઈ મહેશ્વરદાતે ત્યાંથી પ્રયાણ કર્યું.

## धृतांत संग्रह.

३१५

ते केटलेक दिवसे पोताना भैथाल नर्मदापुरीमां आवी पोहोचये।

आपूर्व-

## धृतांत संग्रह.

मुनिराज श्री हंसविजयज्ञ महाराजने विहार कृष्ण देशमां  
थवाथी ते स्थले धर्मनो जीव विशेष थतो जयछे। कृष्ण भूमीना,  
केटलाएक क्षेत्र मुनि विहारना अभावने लाल आहुत धर्मना स्वदप्थी  
अशात छे; केटलाएक जैनभासना संसर्गथी दूषित थांध गया छे अने  
केटलाएक भिध्यात्वथी भविन थता जयछे, तेवा क्षेत्राने मुनिराज  
श्री हंसविजयज्ञ महाराजे पोताना उपदेशथी सुमार्याछे. ए  
महारायना प्रभावथी कृष्ण भूमीमां स्थले स्थले धर्मनो उद्योत थांध  
रघोछे. जैन कृष्णी प्रभ ते महामुनिना दर्शनथी आत्माने कृतार्थ-  
मानी विविध जलाना धर्म काँया करेछे प्रत्येक स्थले प्रभावनाना  
प्रवाह प्रवर्तीनेछे. आना देशमां मुनीओआं अवश्य विहार करवो,  
जोर्छे. के विहारां मुनीओने परीष्ठ सहन करवा ५३, तेवा  
विहार करनार्ह परोपकारी मुनिओने घरेघरो धन्यवाद घटे छे.

मुंबईनीशी कृष्णी दशाओसवाल जैन पाठशालाना चतुर्थ वा-  
र्षिकीपोट्टीनी अडकनक्ल अभोने अवलोडनभाटे भलीछे तेनुं अवलो-  
डनकरतां अभने धर्षेज्ज्ञ आनंद उत्पन्न थायछे. मुंबई क्वी नव-  
रंगीत राजधानीमां वस्ती जैनप्रभामां विधानी अभिवृद्धि करवामां  
साधन भूत एवा के आतानी ज़दर हुती, ते श्री कृष्णी दशा-

૨૧૬

## આતમાનંદ પ્રકાશ.

આશનાગ જૈન પાઠશાળાના સ્થાપનથી ઘણે દરજને પરિગૂર્ણ થયેલી છે. તેમાં ધાર્મિક, વ્યવહારિક અને શારીરક ડેલવણી આપવાની વિતમ પ્રકારની ગોઠવણું કરવામાં આવી છે. આ જીપચોગી જાતાની સ્થાપના કર્યા હજુ લાંબો વર્ષત થયો. નથી, તેટલાં તે પરિવાર ખાતાંએ કે કામ કર્યું છે, તે બેચેનું સંતોષ આપનારૂં છે તેને માટે કે ખાતાના વ્યવસ્થાપકાને સાડું ભાન ધરેછે. ધર્મજ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન આપવાની પદ્ધતિ વિષે બધાં વિદ્વાનોના પ્રયત્નથીજ બાબ્ય અભિપ્રાય છે. મનુષ્યના આત્માનું જાગ્રાતાં જાડુ રહુસ્થ ધર્મ છે, અને તેના જીપર વ્યવહારની સર્વ પ્રવૃત્તિનો આધાર છે ધર્મ હોય તો પ્રવૃત્તિ સારી હોયછે. જનમંડલના ચુહ-વ્યવહાર સભ્ય વિગેરે અગોને વૈરાગ્ય જ્ઞાન જોગ માટે ધર્મની જરૂર છે. ધાર્મિક જ્ઞાનવિના કેવલ વ્યવહાર જ્ઞાન જીપચોગી નથી અધ્યુર્ય જીવનની સમાપ્તિ ધર્મ ભાવનામાંજ હૃતાર્થ છે. તેવી ઉત્તમ ફદ્દતી સાથે આ જૈન પાઠશાળાની પ્રવૃત્તિ જોઇ વિરોધ સંતોષ પેદા થાયછે. પાઠશાળામાં ભાણુતા વિદ્યાર્થીઓની સંખ્યામાં કે ન્યૂનાધિક હેઠાયછે, તે જોઇએ તેટલું સંતોષ કારક નથી તથાપિ એકેદર અભ્યાસીઓની સંખ્યા સારીએ. ઝુંબાપુરી કિરાતલ નગરી એ; તેથી દરેક લતામાંથી અભ્યાસ કરવા આપવાની આનુકૂલતા પણ. ન હોવણે સંભળ છે તથાપિ દરેક ઝુંબઈ નિવૃત્તસી જૈન ચુહસ્થ જો ખંતથી જોતાના પુતેનિ મોષ્ટકવા શિત્તસાહ પરતને તો આ પાઠશાળામાં અભ્યાસીઓની સંખ્યા વધે અરી.

થાલાને અગે-એક પુસ્તક અત્યારેની દોજના કરવામાં આવી છે— જેમાંથી વાચક વુંદું સારો લાભ મેલેબે છે, વિરોધ મુશીની વાત તેણે

## पुस्तक संग्रह.

११७

अते हे, तेमां केन्द्रमेना हस्त लिखित पुस्तकों राखवामां आवया हे. आज आख धणे तथे भुद्रांजित पुस्तकोंमेज संग्रह करवामां आवे हे अने तेमां पर्यु धर्म तथा नीतिना पुस्तकों करतां श्रृंगारना, सांसारिक प्रवृत्तिना अने भट्टभट्टना नोवेलोनी संग्रहा विशेष ढाय हे अमे आशा राखीये छीजे हे; आ पुस्तकालयमां तेवा पुस्तकोंनो संग्रह नहीं करतां धर्म अने नीति पुस्तकोंमेज विशेष संग्रह करवो धर्म तथा नीति शिवायना पुस्तका वाचकवृद्धने बुद्धीज विचार श्रेष्ठी उपर यढावे हे, तेथी पुस्तकालयनो उतम ढेतु यथार्थ यतो नथी.

शालाने अंगे शिक्षणु सुधारकमंडळनी घेऊना करैली हे, ते प्रशासनीय हे. शिक्षकों प्रेतप्रेताना विचार परस्पर हर्षीवे अने ते उपर विवेचन करी तेमां सुधारोवधारो करे—ये पहुती शालाना शिक्षणुने दीपावलारी हे. ते उपरांत विधायीच्यानु मंडळ उष्ण करवामां आवयुं हे अने तेमां विविध विषय उपर यर्चा करवानु के कार्य थाय हे ते खरेखर स्तुत्य हे. आवा यर्चा उपर आपयु करवाना अल्यासथी तेच्या भविष्यमां सारा वक्ता खनीयोके हे धर्म तथा नीतिना विषयने पक्षवित करवायी तेच्याना हृष्यमां ते ते भावना कसी अय हे अने छेवटे तेच्या धार्मिक अने नीतिभानु थाय हे.

विशेष जथावाने आनंद थाय हे हे, आ आताने लगतुं जे आडी गरातुं स्थापन करवामां आवयुं हे, ते सर्वथी उत्तममां उत्तमहे निरावार अने गरीब वर्जना आलडाने निवास तथा शोजनवानी सामयीत्याये ज्ञान हान करवानी ए परमपवित्र महादान

શાલા છે એટલું જ નહીં પણ તે પરોપકાર તથા પુરુષ વૃત્તિને વધારનારી જ્ઞાનોપાસના છે. આ પવિત્ર ખાતાને સહાય કરનાર પુરુષાંત્રા ગુહસ્થેને અમે સહસ્રનાર ધન્યવાહ આ ભીજીછી તે શિવાય ચારીરિક ડેવનાણી અને ડોગ તથા જ્યાપારને લગતી તેલવણીના રાખનેણી કે ચોજના કરવામાં આવે છે, તે બણી પ્રશાંસા પાત્ર છે. શાલાની વ્યવસ્થાપક કમીશીએ પ્રયોગ વખતે સંતોષકારક કાર્ય કરેલું જેવામાં આવેછે. ઢાઈ ઢાઈ હાજરી જોક ન્યૂનાધિક છે તથાપિ જેના ફાર્દિના પ્રવાહને ઉધારે પણ હાનિ થઈ નથી. પરીક્ષાઓના પરિણામ સંતોષકારક છે. જેનું આન તે શાલાના શિક્ષણને ધરેછે. શાલામાં ભણુતાં વિદ્યાર્થીઓને જિતેજન આપવા સ્વાલરશીપ અને વાર્ષિક ધનાભ કે ગુહસ્થેએ આપ્યાંછે, તેમને ધન્યવાહ ધરેછે. શાલાને લગતા હુસાયના ઝડાડા જેતાં વહીવટની વિશાળતા યોગી છે પણ ફાર્દિની વિશાળતા મોટી લાગેછે, એ વિરોધ સંતોષકારક છે. પાઠશાલાને લગતા ધારાની કલમો જેતાં ધારા ધડનારની દીર્ઘ દાખિ ડેખાઈ આવેછે. અજ્ઞાસના યોરણોમાં જોઇએ તેને હજુ સુધ્યારો જરૂરાની જરૂર છે કે યોગ્ય પ્રસંગે અમે જણ્ણાવીશું.

છેવટે હર્ષથી જણ્ણાવીએ છીએ છે, શ્રી કર્ણાંહી દરા ઓસવાળ કેન પાઠશાલાના આ ચતુર્થ દીર્ઘાઈ વાંચી અમે અતિ હાર્ષિત થયા છીએ. અને પ્રતિદિન એ પાઠશાલાની જીનંતિ ધર્મિષ્ઠાએ છીએ. એ પવિત્ર ખાતામાં દ્રોધની સહાય કરનાર ગુહસ્થે, વ્યવસ્થાપક, અને અનુમોદક ખરેખર પ્રશાંસનીએ છે. તેમનું અતુકરૂળ કરવાને અમે ભીજીઓને વિનંતિ કરીએ છીએ.